



रिन्युअेबल अेनर्जी अेंञ्चनियरिंग विभाग
कृषि ँजनेरी अने टेकनोलॉज् कोलेज
आणंए कृषि युनिवर्सिटी
गोधरा-3८६00१

“पुनः प्राप्य ँर्जा स्रोतानी भेतीमां ँपयोगिता अने तेनुं महत्व” अेक दिवसीय भेदूत तालीम कार्यकम

आणंए कृषि युनिवर्सिटी नी कृषि ँजनेरी अने टेकनोलॉज् कोलेज, गोधरा भाते “अेडवान्सड सेन्टर डोर रिसर्च अेन्ड ट्रेडनर्स ट्रेडनींग ओन अेग्रीकल्चरल अेंजिनियरिंग भेजड ँन्टरवेनसनस” प्रोजेकट अंतर्गत रिन्युअेबल अेनर्जी अेंञ्चनियरिंग विभाग अने कृषि विज्ञान केन्द्र, आणंए कृषि युनिवर्सिटी, मुवालीया डार्म, दाहोड ना संयुक्त ँपकमे “पुनः प्राप्य ँर्जा स्रोतानी भेतीमां ँपयोगिता अने तेनुं महत्व” विषय पर अेक दिवसीय भेदूत तालीम कार्यकम तारीभ १५/0२/२0२3 ना रोज रिन्युअेबल अेनर्जी अेंञ्चनियरिंग विभाग, कृषि ँजनेरी अने टेकनोलॉज् कोलेज, गोधरा भाते योजवामां आव्यो. आ कार्यकममां गामः सिंगापुर अने मुनावाणी, तालुकोः सिंगवड, जिल्लो दाहोड थी ४0 जेटली भेदूतो हाजर रखा हता. कार्यकम नी शरूआत पधारेल महमानोनुं पुष्यगुष्य आपीने कराड हती.

आ कार्यकममां अतिथि विशेष तरीके डो. आर. सुब्बैयाह साहेब, आचार्य अने विध्याशाभाअध्यक्षश्री, कृषि ँजनेरी अने टेकनोलॉज्, गोधरा ; डो. ज्. के. लालोर, वैज्ञानिकश्री, कृषि विज्ञान केन्द्र, आणंए कृषि युनिवर्सिटी, मुवालीया डार्म, दाहोड तेमज कृषि ँजनेरी अने टेकनोलॉज् कोलेजना तमाम विभागीय वडाश्रीओ, कोलेज तेमज कृषि विज्ञान केन्द्र, दाहोडना अधिकारीश्रीओ अने कर्मचारीश्रीओ हाजर रखा.

कृषि ँजनेरी अने टेकनोलॉज्, गोधराना आचार्य अने विध्याशाभाअध्यक्षश्री डो. आर. सुब्बैयाह साहेब द्वारा तालीमार्थीओने पुनः प्राप्य ँर्जा स्रोतो थी यालता जुदा जुदा साधनो जेवाके सौर सुकवणी यंत्र, सोलर पम्पिंग सिस्टम, सोलर वोटर हीटिंग सिस्टम, सोलर जटका, सोलर डिस्टीलेशन, सोलर ँन्सेकट ट्रेपिंग सिस्टम तेमज सोडल सोलाराडजेशन जेवी जुदी जुदी पद्धतियोनो भेतीमां ँपयोग केवी रीते करी भेदूत तेनी आवक वधारी शके तेना विशे माहितगार करवामां आवेल हता. डो. ज्. के. लालोर, वैज्ञानिकश्री, कृषि विज्ञान केन्द्र, आणंए कृषि युनिवर्सिटी, दाहोड द्वारा भेदूतोने भेतीमां सौरँर्जाणा ँपयोग अने तेना डायदाओ विषे माहिती आपेल हती.



સદર તાલીમમાં ડૉ. ડી. કે. વ્યાસ, વિભાગીય વડા (આર. ઇ. ઇ.) અને સદર યોજનાના પી. આઈ. કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ, ગોધરા દ્વારા “સૂર્ય ઉર્જાની ખેતીમાં ઉપયોગિતા અને તેનું મહત્વ” અને “બાયોગેસ નું મહત્વ અને તેની ઉપયોગિતા” વિષય પર, ઈજ. જે. શ્રવણકુમાર, આર. ઇ. ઇ. વિભાગ દ્વારા “સૂર્યકુકર અને સૌર સુકવણી યંત્રનું મહત્વ અને તેની ઉપયોગિતા” વિષય પર અને ઈજ. જે. જે. યાવડા, આર. ઇ. ઇ. વિભાગ દ્વારા “જુદા જુદા પ્રકારના બાયોગેસ પ્લાન્ટ અને તેના ફાયદા અને ગેરફાયદા” વિષય પર વ્યાખ્યાન આપવામાં આવેલ હતા. તદ્દપરાંત તાલીમાર્થીઓને બોક્સ ટાઇપ સૂર્યકુકર કેવી રીતે કાર્ય કરે છે અને ટોપ ફિડિંગ અને સાઈડ ફિડિંગ ટાઇપ નિર્ધૂમ ચૂલાનું, સૌર સુકવણી યંત્ર, સોલર ડિસ્ટીલેશન, સોલર પમ્પિંગ સિસ્ટમ અને પેરબોલિક ટાઇપ સૂર્યકુકર પણ સીધું પ્રાયોગિક નિદર્શન કરી બતાવવામાં આવેલ હતું. વધુમાં ખેડૂતોએ સદર તાલીમમાં બતાવેલ બાયોગેસ ની ઉપયોગિતા, બોક્સ ટાઇપ સૂર્યકુકર તેમજ ટોપ ફિડિંગ ટાઇપ નિર્ધૂમ ચૂલા તેમને કેવી રીતે ઉપયોગી થશે તેના અભિપ્રાય પણ આપેલ હતા અને સાઈડ ફિડિંગ ટાઇપ નિર્ધૂમ ચૂલા વિષે વધુમાં વધુ ઉત્સાહ બતાવેલ હતો.

તાલીમના અંતે ઈજ. જે. જે. યાવડા, સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ, આર. ઇ. ઇ. વિભાગ દ્વારા આમંત્રિત મહેમાનો, ખેડૂતો તેમજ આયોજકોની આભાર વિધિ કરવામાં આવી હતી.